



બુલ મધર ફાર્મ,
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

ગીર અને જાફરાબાદી પશુઓના ટેન્ડરથી વેચાણ માટેની જાહેરાત (બીજો પ્રયત્ન)

આથી સરકારમાં નોંધાયેલ રસ ધરાવતી ગૌશાળાઓને જાણ કરવામાં આવે છે કે, બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી ખાતે ગીર ઓલાદનો એક ખસી વાછરડો તથા જાફરાબાદી ઓલાદની ચાર ભેંસના વેચાણ માટે સીલબંધ કવરમાં ટેન્ડર મંગાવવામાં આવે છે. ટેન્ડર ફોર્મ તથા ટેન્ડરની શરતો-બોલીઓ આ સાથે સામેલ છે.

ટેન્ડર ફોર્મ નીચે જણાવેલ સરનામે નીચે સહી કરનારની કચેરીમાં તા. ૦૮/૦૨/૨૦૨૩ સુધીમાં મળી રહે તે રીતે રૂબરૂ બંધ ટપાલથી આ કચેરીને પહોંચતા કરવાના રહેશે. ભાવ પત્રકોના કવર ઉપર મોકલનારનું નામ સરનામું અને “પશુઓના ટેન્ડરથી વેચાણ માટેના ભાવ” એમ સ્પષ્ટ લખવું.

સરનામું : સંશોધન વૈજ્ઞાનિક, બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, ઠેબી ડેમ પાસે,
પ્રતાપપરા, અમરેલી

સંશોધન વૈજ્ઞાનિક

જા. નં. : જૂ.કૃ.યુ./બુ.મ.ફા./ડેરી/ ૪૯૯-૫૦૮ / ૨૦૨૩, અમરેલી તા. ૨૪/૦૧/૨૦૨૩

નકલ રવાના: જાહેરાતની બહોળી પ્રસિધ્ધિ અર્થે

૧. માન. કલેક્ટરશ્રી, અમરેલી જીલ્લો, કલેક્ટરશ્રીની કચેરી, અમરેલી
૨. ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા કચેરી, રાજકમલ ચોક, અમરેલી
૩. નાયબ પશુપાલન નિયામકશ્રી, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, અમરેલી
૪. આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., મોટા ભંડારિયા, અમરેલી
૫. સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કૃષિ સંશોધન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી
૬. પ્રોજેક્ટ કોર્ડિનેટરશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કેરીયા રોડ, અમરેલી
૭. નિયામકશ્રી, આઈ.ટી. સેલ., જૂ.કૃ.યુ., જુનાગઢ (વેબસાઇટ પર મુકવા વિનંતી સહ)
- ૮-૧૦. સરપંચશ્રી, પ્રતાપપરા/વરૂડી/ભૂતિયા, અમરેલી તરફ બહોળી પ્રસિધ્ધિ અર્થે
૧૧. અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર બહોળી પ્રસિધ્ધિ અર્થે

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

ટેન્ડર ફોર્મ : વર્ષ ૨૦૨૨-૨૩

ડીપોઝીટ પહોંચ નં. _____ તા. _____

વેચાણ માટેની ચાર જાફરાબાદી ભેંસની વિગત

ક્રમ	પશુ નામ, ઓળખ નંબર	જન્મ તારીખ	માતાનું નામ, નંબર	પિતાનું નામ	છેલ્લે વિચાણ તા.	છેલ્લે વસૂક્યા તા.	કુલ વિચાણ	૩૦૦ દિવસનું મહત્તમ દૂધ ઉત્પાદન	છેલ્લે ફેળવ્યા તા.	હાલ સગર્ભા / ખાલી	નિકાલનાં કારણો	માંગણીદારની માંગણી (રૂ.)	
												અંકે	શબ્દોમાં
૧	મૌસમી, એલ-૧૧	૦૫-૧૦-૨૦૧૧	મીના, ૧૨-૧૧	---	૧૩-૧૧-૨૦૧૯	૨૮-૦૨-૨૦૨૧	૩	૩૩૪૮.૮	૦૮-૧૧-૨૦૨૧	ખાલી	૧) છેલ્લા ૩ વર્ષથી સગર્ભા ન થતાં ખાલી છે ૨) Polycystic ovary છે		
૨	નેના, ૧૪-૧૫	૧૭-૦૩-૨૦૧૫	નુંની, એએમ ૮-૧૧	ભોલેનાથ	૨૭-૧૧-૨૦૨૧	૦૧-૦૭-૨૦૨૨	૨	૧૭૨૦.૪	---	ખાલી	૧) બે આંચળ બંધ છે ૨) ઇચ્છનીય ઘણા સરેરાશ કરતાં ઓછું દૂધ ઉત્પાદન છે ૩) વિચાણના ૧ વર્ષ બાદ પણ ગરમીમાં આવેલ નથી		
૩	જમના, ૩૩-૧૫	૧૫-૦૮-૨૦૧૫	જલ્પા, એલ-૧૧	મોતી	૨૮-૦૧-૨૦૨૦	૨૪-૦૧-૨૦૨૧	૧	૨૫૪૫.૭	૨૬-૧૧-૨૦૨૨	ખાલી	૧) છેલ્લા ૨.૫ વર્ષથી સગર્ભા ન થતાં ખાલી છે ૨) Polycystic ovary છે		
૪	મણી, ૩૫-૧૪	૧૧-૧૨-૨૦૧૪	માણકી, ૧૮-૧૧	લક્ષમણ	૦૧-૧૦-૨૦૨૨	---	૪	૨૨૧૩.૩	---	ખાલી	૧) વિચાણ પહેલાં અને પછી અવાર નવાર પ્રજનન અંગોનું પ્રોલેપ્સ થતું હોવાથી ૨) શુદ્ધ ઓલાદના લક્ષણોનો અભાવ		

વેચાણ માટેના ગીર બે ખસી વાછરડાઓની યાદી

ક્રમ	નામ, ઓળખ નંબર	જન્મ તારીખ	ઉંમર	માતાનું નામ, નંબર	પિતાનું નામ	શારીરિક ખોડખાપણ	માંગણીદારની માંગણી (રૂ.)	
							અંકે	શબ્દોમાં
૧	૧-૨૧	૨૩-૦૩-૨૧	૨૦ માસ	પીકું, ૮૫-૧૪	મોહન	નથી		

માંગણીદારનું નામ : માંગણીદારની સહી :

સરનામું : ફોન નંબર :

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

પશુ વેચાણના ટેન્ડરની શરતો

- ૧) સરકારશ્રીના તા. ૨૪/૦૩/૨૦૨૧ના પત્ર અનુસાર આ જાહેરાત ફક્ત સરકારમાં નોંધાયેલ ગૌશાળાઓને લાગુ પડે છે જેમાં કોઈપણ વ્યક્તિગત પશુપાલક કે ખેડૂત ભાગ લઈ શકશે નહીં.
- ૨) તા. ૨૩-૦૧-૨૦૨૩ થી તા. ૦૭-૦૨-૨૦૨૩ દરમિયાન, ટેન્ડર ફોર્મનાં રૂ. ૨૦૦/- રોકડા ભરી અત્રેની કચેરીમાંથી ૮-૦૦ થી ૧૨-૦૦ તથા ૩-૦૦ થી ૬-૦૦ દરમિયાન જાહેર રજા સિવાયના દિવસોમાં ટેન્ડર ફોર્મ મેળવવાનાં રહેશે. ટેન્ડર ફોર્મનાં રૂપિયા પરત મળવાપાત્ર નથી.
- ૩) ટેન્ડર સાથે રૂ. ૨૦૦૦/- (રૂપિયા બે હજાર પુરા) ડીપોઝીટ તરીકે અત્રેની કચેરીએ ભરવાનાં રહેશે. ટેન્ડરમાં ડીપોઝીટ ભર્યાનો પહોંચ નંબર અચૂક લખવાનો રહેશે. વેચાણની કામગીરી પૂર્ણ થયે, ડીપોઝીટના નાણાં, અસલ પહોંચ સામે પરત કરવામાં આવશે.
- ૪) ટેન્ડર ફોર્મ સાથે ગૌશાળાની સરકારશ્રીમાં નોંધણી થયાનો આધાર જોડવાનો રહેશે અન્યથા ટેન્ડર અમાન્ય ગણાશે.
- ૫) ટેન્ડર ફોર્મમાં દરેક પશુઓની જરૂરી વિગત દર્શાવેલ છે, ગૌશાળા જે પશુ / પશુઓ ખરીદ કરવા ઇચ્છે, તેને સંપૂર્ણ રીતે જોઈ-ચકાસી, પોતાની સમજ, સૂઝ હોશિયારી તથા જવાબદારીથી તેની સામે કિંમત લખવાની રહેશે.
- ૬) ટેન્ડર ફોર્મમાં ચેક-ચાક વગર અંક તેમજ શબ્દોમાં કિંમત લખવી, કિંમતમાં ચેક-ચાક થયેલ હોય તો તેની સામે ટુંકી સહી કરવી.
- ૭) વેચાણમાં રાખેલ પશુઓને તા. ૨૩-૦૧-૨૦૨૩ થી તા. ૦૭-૦૨-૨૦૨૩ દરમિયાન ઓફીસ સમયે અત્રેના ફાર્મમાં જોઈ શકશે.
- ૮) ભરેલા ટેન્ડર ફોર્મ બંધ કવરમાં તા. ૦૮-૦૨-૨૦૨૩ સુધીમાં અત્રેની કચેરીમાં મળી જાય તે રીતે રૂબરૂ હાથો-હાથ પહોંચતા કરવાનાં રહેશે / કચેરીમાં રૂબરૂ જમાં કરવાના રહેશે.
- ૯) ભરેલા ટેન્ડર તા. ૧૦-૦૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નિયત કમીટી ધ્વારા અત્રેની કચેરીમાં ખોલવામાં આવશે.
- ૧૦) માંગણીદાર ગૌશાળાની ડીપોઝીટ પેટે ભરેલ રકમની અસલ પહોંચ કચેરીમાં રજુ કરી, ડીપોઝીટ પરત મેળવી લેવાની જવાબદારી માંગણીદાર ગૌશાળાની પોતાની રહેશે અને તા. ૨૩-૦૨-૨૦૨૩ સુધીમાં ડીપોઝીટ પરત નહિ લઈ જાય તો તેમની ડીપોઝીટ જપ્ત થશે.
- ૧૧) જે પશુની ભરેલ કિંમત સૌથી વધુ હશે તે પશુને જે-તે ટેન્ડર ભરનાર ગૌશાળાને વેચાણ કરવામાં આવશે. સદર પશુની પૂર્ણ રકમ દિવસ ત્રણમાં (તા. ૧૦-૦૨-૨૦૨૩ થી તા. ૧૨-૦૨-૨૦૨૩ સુધીમાં) ભરી અત્રેના ફાર્મમાંથી પશુ લઈ જવાનાં રહેશે. ઉપરોક્ત સમય દરમિયાન પશુપાલક પશુ ન લઈ જાયતો, તા. ૧૩-૦૨-૨૦૨૩ પછી વધારાનાં દરેક દિવસ માટે પશુ દીઠ દૈનિક રૂ. ૨૦૦/- ખાધા-ખોરાકી પેટે વસૂલ કરવામાં આવશે.

(...૨...પાછળ)

(...૨...)

- ૧૨) તા. ૨૩-૦૨-૨૦૨૩ પછી પણ પશુપાલક પશુઓ ન લઈ જાય તો તેમની ડીપોઝીટ જપ્ત થશે અને ત્યાર પછી તેમને પશુ વેચાણ આપવામાં આવશે નહીં.
- ૧૩) કોઈપણ સંજોગોમાં તા. ૧૧-૦૨-૨૦૨૩ પહેલાં પશુઓ આપવામાં આવશે નહીં.
- ૧૪) ટેન્ડર પાસ થયું કે નાપાસ તે અત્રેની કચેરીએથી જાણવાની જવાબદારી ગૌશાળાની પોતાની રહેશે. આ સંદર્ભમાં અત્રેની ઓફિસ ધ્વારા કોઈપણ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં તથા તે અંગે કોઈ જવાબદારી અત્રેની કચેરીની રહેશે નહીં.
- ૧૫) ટેન્ડર પાસ થયા પછી તા. ૨૩-૦૨-૨૦૨૩ સુધીમાં પશુઓ ન લઈ જાય અને તે દરમિયાન પશુને કોઈ ઈજા થાય અથવા તો મૃત્યુ થાય તો આ કેન્દ્રની જવાબદારી રહેશે નહીં અને ભરેલ રકમ પરત આપવામાં આવશે નહીં.
- ૧૬) પશુ લઈ જતી વખતે ગૌશાળાએ પોતાના દોરડા, દોરી, જરૂરી માણસો સાથે લાવવાના રહેશે. અત્રેની કચેરીએથી કોઈ પણ પ્રકારના સાધનો અથવા માણસો આપવામાં આવશે નહીં. પશુ લઈ જવાનો સમય ૦૮-૦૦ થી ૧૨-૦૦ તથા ૦૩-૦૦ થી ૦૬-૦૦ રહેશે.
- ૧૭) કોઈપણ વાદ-વિવાદમાં વેચાણ-કમીટીનો નિર્ણય આખરી રહેશે તેમજ સૌને બંધનકર્તા રહેશે.
- ૧૮) દરેક ગૌશાળાએ ટેન્ડર ફોર્મ સાથે જોડેલ શરતો વાંચી સમજી-વિચારીને કિંમત ભરવાની રહેશે.
- ૧૯) અત્રેથી વેચાણ પામેલ જાનવરો પૈકી એકપણ જાનવર કસાઈવાડે ન જાય તેની સંપૂર્ણ જવાબદારી પશુ ખરીદનાર ગૌશાળાની રહેશે. આ અંગેની કોઈ પણ જવાબદારી આ કચેરીની રહેશે નહીં.
- ૨૦) ટેન્ડર વેચાણથી ભાવપત્રકો ખોલવા સુધીની પ્રક્રિયા દરમિયાન કોઈ પશુ મરણ પામે તો તે પશુની માંગણી આપોઆપ રદ ગણવામાં આવશે.
- ૨૧) દરેક પશુપાલકે સંપૂર્ણ રીતે જોઈ, ચકાસી ટેન્ડર ભરવાના રહેશે. ટેન્ડર પાસ થયા પછી કોઈ પણ પશુમાં ખામી કે તકલીફ ગૌશાળાના ધ્યાન પર આવે તો તે અંગેની જવાબદારી આ કચેરીની રહેશે નહીં.
- ૨૨) વેચાણ થયેલ પશુ કોઈપણ સંજોગોમાં કચેરી સમય બાદ અત્રેથી લઈ જવા દેવામાં આવશે નહીં અને તેનો ગેઈટ પાસ કાઢી આપવામાં આવશે નહીં.

સ્થળ : બુ.મ.ફા., જુ.ફુ.યુ., અમરેલી

તારીખ : ૨૩-૦૧-૨૦૨૩



સંશોધન વૈજ્ઞાનિક

બુલ મધર ફાર્મ, જુ.ફુ.યુ., અમરેલી

માંગણીદારની સહી :